



COVID-19 સામે પ્રતિક્રિયા કરવામાં સપ્ટેમ્બર 7 થી અમલી બનતા બ્રેમ્પટન ટ્રાન્ઝિટ સર્વિસમાં ફેરફારો

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓગસ્ટ 20, 2021) – આપણી ટ્રાન્ઝિટ સિસ્ટમ શહેરની આસપાસ લોકોને કાર્યક્ષમ રીતે હેરફેર કરાવી શકતી હોવાની ખાતરી કરાવવા, નીચેના બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રૂટ્સના સમયપત્રકો સપ્ટેમ્બર 7, 2021 થી આગળ સૂચના આપવામાં આવે નહિ ત્યાં સુધી અમલમાં રહેશે.

- **501 ઝુમ ક્વીન:** વીકડેઝ (અઠવાડિક કામકાજના દિવસો) સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **502 ઝુમ મેઈન:** વીકડેઝ, શનિવાર અને રવિવારના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે.
- **505 ઝુમ બોવેર્થ:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **511/ 511A ઝુમ સ્ટીવસ:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **1 ક્વીન:** વીકડેઝ અને રવિવારના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે.
- **2 મેઈન:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **3/ 3A મેકલાફ્લિન:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **4/4A ચિંગકુસી:** વીકડેઝના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે અને સ્કૂલના વધારાના ફેરાઓ ફરી અમલી બનાવ્યા
- **5/5A બોવાર્ડ:** વીકડેઝના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે.
- **7/7A કેનેડી:** વીકડેઝ, શનિવાર અને રવિવારના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે અને PM (બપોર પછીની) સ્કૂલના વધારાના ફેરાઓ ફરી અમલી બનાવ્યા
- **9 વોડેન:** વીકડેઝના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે અને PM (બપોર પછીની) સ્કૂલના વધારાના ફેરાઓ ફરી અમલી બનાવ્યા
- **11/11A સ્ટીવસ:** વીકડેઝ, શનિવાર અને રવિવારના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે.
- **12 ગ્રેનોબલ:** શનિવારના સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **13 એવોનડેલ:** શનિવારના સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **14/14A ટોરબ્રામ:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **15/15A બ્રેમલી:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **16 સાઉથગેટ:** શનિવારના સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **17 હાઉડન:** શનિવારના સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **19 ફર્નફિલ્ડ:** શનિવારના સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **23 સેન્ડલવૂડ:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **30 એરપોર્ટ રોડ:** શનિવાર અને રવિવારના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે.
- **31 મેકવીન:** વીકડેઝ અને શનિવારના સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **32 ફાધર ટોબિન:** વીકડેઝના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે અને સ્કૂલના વધારાના ફેરાઓ ફરી અમલી બનાવ્યા
- **33 પીટર રોબર્ટ્સન:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **50/ 50A:** વીકડેઝ સમયપત્રક સંબંધિત અદ્યતન માહિતી
- **54 કાઉન્ટી કોર્ટ:** વીકડેઝ અને શનિવારના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે.
- **55 એલબર્ન માર્ફલ:** વીકડેઝના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે અને PM (બપોર પછીના) સ્કૂલના વધારાના ફેરાઓ ફરી અમલી બનાવ્યા
- **57 ચારોલેઈસ:** વીકડેઝના સમયપત્રકો સર્વિસ વિશ્વાસપાત્રતા સુધારવા અનુકૂળ કર્યા છે અને સ્કૂલના વધારાના ફેરાઓ ફરી અમલી બનાવ્યા



- **199 UTM એક્સપ્રેસ:** વીકડેઝ સર્વિસ ફરી અમલી બનાવી
- **200-217 i-Ride (આઈ-રાઈડ) સ્કૂલ સ્પેશિયલ્સ:** વીકડેઝ સેવા સંબંધિત અદ્યતન માહિતી

સોમવાર, સપ્ટેમ્બર 6 નાં રોજ, લેબર ડે માટે બ્રેમ્પટન ટ્રાન્ઝિટ રવિવાર/રજના દિવસ માટેની સેવા પૂરી પાડશે, જેમાં કેટલાક રદબાતલ રૂટ્સ હજુ પણ અમલમાં રહેશે. લેબર ડે પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ રહેશે. સેકન્ડરી સ્કૂલ સમર્પિત રૂટ્સ મંગળવાર, સપ્ટેમ્બર 7 નાં રોજ ફરીથી શરૂ થશે.

કૃપા કરી પ્રવાસ કરતા પહેલાં રૂટના સમયપત્રકો તપાસો. બ્રેમલી, બ્રેમ્પટન ગેટવે અને ડાઉનટાઉનમાં ટર્મિનલ બિલ્ડિંગના કામકાજના ક્લાકો સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી છે. ટ્રિનિટી કોમન ટર્મિનલ બંધ રહે છે. વધુ વિગતો માટે વેબસાઈટ www.bramptontransit.com જુઓ અથવા સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર કોલ કરો. આપણે સૌએ આપણાં સમુદાયને સુરક્ષિત રાખવા આપણો ભાગ ભજવવાની જરૂર છે. કૃપા કરી યાદ રાખશો:

- ટર્મિનલ્સ પર અને બસમાં પ્રવાસ કરતી વખતે મારસ્ક્સ પહેરવા અનિવાર્ય છે, મારસ્ક્સ ચુસ્તપણે બંધબેસતા અને બધાં સમયે તમારું નાક, મોઢું અને દાઢી ઢંકાયેલું હોવું જોઈએ.
- ટર્મિનલ્સમાં અને બસ સ્ટોપ્સ પર મારસ્ક પહેર્યો હોય તો પણ વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર જાળવો.
- પ્રવાસ કરતી વખતે તમારું પોતાનું અંગત ડિસઈન્ફેક્ટન્ટ (ચેપનાશક પદાર્થ), જેમ કે હેન્ડ સેનિટાઈઝર કે વાઈપ્સ સાથે રાખો, અને પોતાના હાથ અવારનવાર ધોતા રહો.
- જો તમે બીમાર હો તો, કૃપા કરી ટ્રાન્ઝિટમાં સવારી કરવાનું ટાળો. સૌથી નજીકની COVID-19 એસેસમેન્ટ સાઈટ પર પરીક્ષણ ચોક્કસ કરાવો અને જાહેર આરોગ્ય સૂચનો અનુસરો.

COVID-19 સુરક્ષા ઉપાયો

વધારે સારી સફાઈ અને સ્વચ્છતા (સેનિટાઈઝિંગ) સમયપત્રક અમલમાં રહે છે. બ્રેમ્પટન ટ્રાન્ઝિટનું લક્ષ્ય દર 48 કલાકે તમામ સખત સપાટીઓ, ઓપરેટર કમ્પાર્ટમેન્ટ્સ અને બેઠકોને ચેપરહિત કરવાનું છે. મોટા ભાગની બસોને હાલમાં દર 24 કલાકે સેનિટાઈઝ કરવામાં આવે છે. સખત સપાટીઓ ધરાવતી સગવડો અને ટર્મિનલ્સને રોજંદા ધોરણે સાફ અને સેનિટાઈઝ કરવામાં આવે છે.

પીલ પબ્લિક હેલ્થના માર્ગદર્શન પ્રમાણે, ઉતારુઓને યાદ અપાવવામાં આવે છે કે બસોમાં અને ટર્મિનલ્સ પર મારસ્ક્સ પહેરવા અનિવાર્ય છે. સીટી ઓફ બ્રેમ્પટન જોખમો પર દેખરેખ ચાલુ રાખવા પીલ પબ્લિક હેલ્થ અને બ્રેમ્પટન ઇમરજન્સી મેનેજમેન્ટ ઓફિસમાં પોતાના ભાગીદારો સાથે ઘનિષ્ઠપણે કામ કરી રહ્યું છે.

અદ્યતન માહિતી નિયમિત મેળવવા વેબસાઈટ www.brampton.ca/COVID19 અને www.bramptontransit.com જોતા રહો અથવા સર્વિસ અપડેટ્સ માટે Twitter પર [@bramptontransit](https://twitter.com/bramptontransit) ને અનુસરો. કોઈ પ્રશ્નો સીધા બ્રેમ્પટન ટ્રાન્ઝિટના સંપર્ક કેન્દ્રને 905.874.2999 નંબર પર પૂછી શકાય છે.

-30-

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈનથ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca